Regd. Office: 597/2A, Somnath Road, Dabhel, Nani Daman, Daman & Diu - 396 210. (India)

Corp Office: Cello House, Corporate Avenue, 'B' wing, 8th Floor, Sonawala Road, Goregaon (east), Mumbai-400063, (India),

 $\textbf{Tel}{:}~022~6997~0000~\textbf{E-mail}{:}~cello.sales@celloworld.com,~grievance@celloworld.com$

Website: www.corporate.celloworld.com CIN: U25209DD2018PLC009865

July 19, 2024

BSE Limited	National Stock Exchange of India Limited
Phiroze Jeejeebhoy Towers, Dalal Street,	Exchange Plaza, C-1, Block - G, Bandra Kurla
Mumbai - 400 001	Complex, Bandra (East), Mumbai - 400 051
Scrip Code: 544012	Symbol: CELLO

Sub: Newspaper Publication – Disclosure under Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015.

Dear Sir(s)/ Madam(s),

With reference to the captioned subject, please find enclosed herewith the Newspaper advertisement with respect to 6th Annual General Meeting to be held on Saturday, August 10, 2024 at 03:30 p.m. through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM), published in the Business Standard (English -National Daily All Edition)" and "the Gujarati Mitra (Gujarati Edition)" on July 19, 2024 in compliance with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

You are requested to kindly take note of the same.

Thanking you.

Yours faithfully,

For Cello World Limited

Hemangi
Pragnesh Trivedi
Pragnesh Trivedi

Hemangi Trivedi Company Secretary and Compliance Officer

Encl: As above

Email: investor@reproindialtd.com Website: www.reproindialtd.co



RALLIS INDIA LIMITED

A TATA Enterprise

CIN:L36992MH1948PLC014083

Extract of Statement of Financial Results for the guarter ended 30 June, 2024

(₹ in crores)

(\lambda in tioles)					
Particulars	Quarter ended 30 June, 2024	Quarter ended 31 March, 2024	Quarter ended 30 June, 2023	Year ended 31 March, 2024	
	Unaudited	Unaudited	Unaudited	Audited	
Total income from Operations	783	436	782	2,648	
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	65	(29)	85	195	
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	65	(29)	85	196	
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	48	(21)	63	148	
5. Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	46	(22)	62	148	
6. Equity Share Capital	19	19	19	19	
7. Other Equity	-	-	-	1,810	
8. Basic and diluted earnings per share (of ₹1 /- each)	2.46	(1.07)	3.26	7.61	

cello

- a. The above is an extract of the detailed format of the unaudited financial results for the quarter ended 30 June, 2024 filed with the Stock Exchanges under Regulation 33. The full format of the unaudited financial results for the quarter ended 30 June, 2024 are available on the Stock Exchanges websites viz. www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.rallis.com.
- b. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 18 July, 2024. The statutory auditors have expressed an unqualified review conclusion
- c. Financial results for all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles of Ind AS notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time.
- d. The Company's business is seasonal in nature and the performance can be impacted by weather conditions and cropping pattern. e. The Company has one reportable business segment viz. "Agri-Inputs".

CELLO WORLD LIMITED

Instructions for Remote E-voting and E-voting during AGM:

India Pvt. Ltd. at https://instavote.linkintime.co.in.

procedure in a fair and transparent manner.

the Financial Year 2023-24 including Financial Statements for the year

p.m. (IST). Thereafter, the remote e-voting module shall be disabled by LIIPL for voting.

resolution set forth in the Notice of AGM using remote e-voting or voting at the AGM.

the AGM or sending request to rnt.helpdesk@linkintime.co.in

(i) In the case of Shares held in physical mode:

(ii) In the case of Shares held in Demat mode:

process followed and advised by the DP.

- f. Exceptional item as disclosed in the column (year ended 31 March, 2024) comprise profit on sale of flat (net of costs).
- g. The figures for the quarter ended 31 March, 2024 are the balancing figures between audited figures in respect of the full financial year and the published year to date figures upto nine months ended 31 December, 2023. Also the figures upto the end of the third guarter had only been reviewed and not subjected to audit.
- h. The Indian Parliament has approved the Code on Social Security, 2020 which would impact the contributions by the company towards Provident Fund and Gratuity. The Ministry of Labour and Employment had released draft rules for the Code on Social Security, 2020 on November 13, 2020, and has invited suggestions from stakeholders which are under active consideration by the Ministry. The Company will assess the impact and its evaluation once the subject rules are notified and will give appropriate impact in its financial statements in the period in which, the Code becomes effective and the related rules to determine the financial impact
- i. Amounts for the current period and previous periods are rounded off to the nearest ₹ crores.

Tel. No.: 022 - 69970000; CIN: U25209DD2018PLC009865

For and on behalf of Rallis India Limited

Gvanendra Shukla Place: Mumbai Date: 18 July, 2024 Managing Director & CEO

Registered Office: 23rd Floor, VIOS Tower, New Cuffe Parade, Off Eastern Freeway, Wadala, Mumbai - 400 03 Tel: +91 22 6232 7400 Email: investor_relations@rallis.com Website: www.rallis.com

Corporate Office: Cello House, Corporate Avenue, 'B' Wing, 8th Floor, Sonawala Road, Goregaon (East), Mumbai - 400 063, (India),

NOTICE OF 6TH ANNUAL GENERAL MEETING AND REMOTE

E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that the 6 th Annual General Meeting (AGM) of the Members of Cello World Limited ("the Company") will be held on

Saturday, August 10, 2024 at 03.30 p.m. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") (hereinafter

referred to as "electronic mode") to transact the business, as set out in the Notice convening the said Meeting and the Explanatory

Statement thereto, in compliance with the provisions of the Companies Act, 2013 & Rules made thereunder and the Securities and

Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with the Ministry of Corporate Affairs

("MCA") circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021, May 5, 2022, and December 28,

2022 and Circulars dated May 12, 2020, January 15, 2021, May 13, 2022 and January 5, 2023 issued by the Securities and Exchange

Board of India, without the physical presence of Members at a common venue. Members will be able to attend and participate in the

ensuing AGM through audio-visual means and the facility of appointment of proxy will not be available. Members attending the AGM

In compliance with the relevant circulars, the Notice of the AGM along with explanatory statement and Annual Report of the Company for

email address are registered with the Company/Depository Participant(s) and/ or Link Intime India Pvt. Ltd. ("RTA") on July 18, 2024. The

same is also available on the Company's website <u>www.corporate.celloworld.com</u> and on the website of BSE Limited at <u>www.bseindia.com</u>

and the National Stock Exchange of India Limited at www.nseindia.com respectively and on the website of the Company's RTA, Link Intime

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and

Administration) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Regulations) Regulations. 2015, the Company is pleased to offer its Members (holding shares either in physical and in electronic form) the facility to exercise their

vote by electronic means (Remote E-voting) as well as e-voting at the AGM on all the resolutions set forth in the Notice of the 6 th AGM.

The Company has engaged the services of Link Intime India Pvt. Ltd. ("LIIPL") to provide e-voting facility. Mr. Dharmesh Sarvaiya, Proprietor of M/s. Sarvaiya & Co., the Company Secretaries, has been appointed as the scrutinizer to scrutinize the remote e-voting

The remote e-voting period commences on Wednesday, August 07, 2024 at 9.00 a.m. (IST) and ends on Friday, August 09, 2024 at 5.00

The voting rights of Members shall be in proportion to the Equity Shares held by them in the paid-up Equity Share Capital of the Company

as on August 02, 2024 ("cut-off date"). Any person, who is Member of the Company as on cut-off date is eligible to cast vote on all the

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after dispatch of the Notice and holding shares as of the cut-off date i.e. August 02, 2024, may obtain the login ID and password by following the instruction as mentioned in the Notice of

Members who are present at the AGM through VC/ OAVM and have not casted their vote on the resolutions through remote e-voting shall be eligible to vote through e-voting during the AGM. The detailed procedure and instructions for e-voting during the AGM are mentioned in

In case the Member has not registered their email address with the Company/RTA/Depositories, the following instructions to be followed:

The Member may please contact the Depository Participant ("DP") and register the email address in the demat account as per the

The Member may please email to RTA at rnt.helpdesk@linkintime.co.in or the Company at grievance@celloworld.com.

through audio visual means will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

Regd. Office: 597/2A, Somnath Road, Dabhel, Nani Daman, Daman & Diu - 396 210. (India)

Email: grievance@celloworld.com; Website: www.corporate.celloworld.com

balkrishna industries limited

CIN: L99999MH1961PLC012185

Regd. Office: - B-66, Waluj MIDC, Waluj Industrial Area,
Chhatrapati Sambhajinagar - 431136, Maharashtra, India.
Tel No. +91 22 6666 3800 Fax: +91 22 6666 3998/99

Website: www.bkt-tires.com E-mail: shares@bkt-tires.com

NOTICE
TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO
INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF) ACCOUNT

Notice is hereby given that pursuant to provisions of Section 124 of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 notified by Ministry of Corporate Affairs, as amended from time to time (collectively referred as "IEPF Rules").

Pursuant to the IEPF Rules all the equity shares of the Company in respect of which dividends unpaid or unclaimed by the Shareholders for seven consecutive years or more, shall be transferred to IEPF Account established by the Central Government, as per the procedure stipulated in the said Rules

Shareholders are advised to claim the unclaimed dividend amount fro the year 2016-17 onwards immediately on or before 14th October, 2024 by sending a request letter mentioning your DP ID/Client ID or folio no. along with self-attested copy of PAN Card and address proof, original cancelled cheque leaf immediately to Kfin Technologies Limited (KFintech), the Registrar and Share Transfer Agent of the Company or to the Company. The Final dividend which was declared by the Company on 9th September, 2017 for financial year 2016-17, which remained unclaimed/unpaid for a period of seven years from the date of such transfer will be credited to IEPF on due date of transfer i.e 14th October, 2024. In case the Registrar & Share Transfer agent/Company does not receive any communication from the concerned shareholder on or before 14th October, 2024, the Company shall proceed to transfer the shares to IEPF Authority, without any further notice, as per procedure set out in IEPF Rules.

The Company has communicated individually to concerned shareholder at their latest available addresses, whose shares are due for transfer to the IEPF Account for taking necessary steps to claim dividend from the financial year 2016-17 onwards. A List of such shareholders, who have not encashed their dividends for seven consecutive years and whose shares are, therefore liable to be transferred to the IEPF Authority is available or website of the Company www.bkt-tires.com.

Shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may please note that the Company would be issuing new share certificates in lieu of the original share certificates held by them for the purpose of conversion into demat form and subsequen transfer to demat accounts opened by IEPF Authority. Upon such issue the original share certificates which are registered in their name shal stand automatically cancelled and be deemed non-negotiable. In case or shareholders holding shares in demat form, the transfer of shares to the demat accounts of IEPF Authority shall be effected by the Company through the respective Depositories by way of Corporate Action

Shareholders may please note that the shares and unclaimed amounts transferred to IEPF can be claimed back from the IEPF Authority after following the procedure prescribed under Companies Act, 2013 and IEPF Rules. Please note that no claim shall lie against the Company in respect o unclaimed amount and shares which will be transferred to IÉPF pursuan to provisions of said rules, as amended from time to time.

In case of any queries/clarification on the subject matter, the shareholder nay contact the Registrar & Transfer Agent (ŔTA)/Company at:

Kfin Technologies Ltd Unit: (Unit: Balkrishna Industries Limited) Mr. Rajesh Patro Manager (Corporate Registry) SeleniumTowerB, PlotNo. 31-32 Gachibowli,Financial District,

Nanakramguda Hyderabad - 500 032 Toll free: 1-800-309-4001 Email: rajesh.patro@kfintech.com einward.ris@kfintech.com

Balkrishna Industries Limite BKT House, C/15, Trade world, Kamala Mills Compound. Senapati Bapat Marg. Lower Parel, Mumbai 400013, Tel No. 022-66663800. Fax No. 022-66663898 or at email: shares@bkt-tires.com

For Balkrishna Industries Limited Sd/-Vipul Shah

Director & Company Secretary DIN: 05199526 Place : Mumbai Date : 18.07.2024

Place: Chennai

Date: 18.07.2024

REPRO INDIA LIMITED EPRO

CIN: L22200MH1993PLC071431

Reg. Office: 11th Floor, Sun Paradise Business Plaza, 'B' Wing, Senapati Bapat Marg, Lower Parel, Mumbai – 400 013, India Phone: 022-71914000 Fax: 022-71914001 CONTENT AGGREGATION TO EFFECTIVE DISSEMINATION

NOTICE OF THE 31St annual general meeting and information on e-voting

NOTICE is hereby given that the 31" Annual General Meeting ('AGM') of the Members of Repro India Limited ('the Company') is scheduled to be held on Friday, August 09, 2024 at 3.30 p.m. (IST) through Video Conferencing ('VC')Other Audio Visual Means ('OAVM') to transact the businesses as set out in the Notice of the AGM. In compliance with the relevant Circulars issued by the Ministry of Corporate Affairs ('MCA') and the Securities and Exchange Board of India ('SEBI'), the 31" AGM of the Company is being held through VC/OAVM without the physical presence of the Members at a common venue and the Notice of the 31" AGM along with the Annual Report for Financial Year 2023-24 has been sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company/Depository Participant(s)/Registrar and Share Transfer Agent.

The AGM Notice and the Annual Report can be accessed from the website of the Company at www.reproindialtd.com and on the website of the Stock Exchanges i.e., BSE limited at www.reproindialtd.com and the National Stock Exchange of India Limited at www.veoting.nsdl.com. and the National Stock Exchange of India Limited at www.veoting.nsdl.com. The Company has engaged the services of NSDL for conducting the 31" AGM through VC/OAVM enabling participation of the Members at the Meeting, providing e-voting facility prior to the Meeting ('Remote E-voting'), and at the Meeting in tonenection with the business to be transacted thereat. The link for Members to attend the Meeting through VC/OVAM or view the live webcast will be available in the Members' login where the EVSN of the Company is displayed.

Instructions for remote e-voting and e-voting during the AGM:

a. Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule

through VC/OVAM or view the live webcast will be available in the Members' login where the EVSN of the Company is displayed.

Instructions for remote e-voting and e-voting during the AGM:

a. Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard - 2 on General Meetings issued by the Institute of Company Secretaries of India, the Company is providing remote e-voting facility to its Members to cast their vote by electronic means on the resolutions set out in the Notice of the 31" AGM of the Company.

b. The remote e-voting period commences on Tuesday, August 06, 2024 at 9.00 a.m. (IST) and will end on Thursday, August 08, 2024 at 5.00 p.m. (IST).

c. Voting through remote e-voting will not be permitted beyond 5.00 p.m. on Thursday, August 08, 2024 E-voting shall also be made available at the 31" AGM and the members attending the meeting through VC/OAVM who have not cast their vote through remote e-voting shall be able to vote via e-voting at the 31" AGM.

d. The Members who have already cast their vote through remote e-voting may attend the AGM but shall NOT be entitled to cast their vote again.

c. Cut-off Date for remote e-voting: Friday, August 02, 2024

f. Any person who acquires shares of the Company and becomes a Member of the Company after the dispatch of AGM Notice and holds shares as on the Cut-off Date i.e. August 02, 2024 are requested to refer the Notice of AGM for the process to be adopted for obtaining the User ID and Password for casting the vote.

g. Members holding shares in physical or in dematerialized form as on August 02, 2024, shall be entitled to vote.

h. The manner of voting remotely or during the AGM for Members holding shares in dematerialized mode, physical mode and for the Members who have not registered their email addresses has been provided in the N

A person who is not a member as on the cut-off date should treat the Notice for information purpose only. A person whose name is recorded in the Register of Members or in the register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date entitled to avail the facility of remote e-voting before and during the AGM.

the AGM. In case of any queries/grievances pertaining to voting by electronic means, please refer the Frequently Asked Questions ('FAQs') for shareholders and the e-voting user manual for shareholders available in the download section of www.evoting.nsdl.com or call at 022 - 4886 7000 and 022 - 2499 7000 or send a request at evoting@nsdl.co.in. For any grievances relating to voting by electronic means, members may contact Ms. Pallavi Mhatre, Senior Manager - NSDL at pallavid@nsdl.co.in

request at evolutions. The many systems of the companies means, members may contact Ms. Pallavi Mhatre, Senior Manager - NSDL at pallavid@nsdl.co.in

Book Closure: Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the Listing Regulations, that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from August 03, 2024 to August 09, 2024 (both days inclusive).

Members holding shares in physical mode and who have not updated their email addresses with the Company are requested to update their email address by sending a duly signed request letter to the Registrar and Transfer Agents of the Company, M's Link Intime India Private Limited by providing the Folio No. and name of the shareholder. Members holding shares in dematerialized mode are requested to update/register their email addresses with the relevant Depository Participant(s). The relevant documents pertaining to the Items of business to be transacted at the 31st AGM are available for inspection through electronic mode. Members are requested to write to the Company on investor@reproindialtd.com for inspection of the said documents.

flembers who would like to express their views or ask questions may ask the same by

Company Secretary & Compliance Office

sending request from their registered email address mentioning their name, DP ID and Client ID / folio number, PAN, mobile number along with their queries a investor@reproindialtd.com on or before Wednesday, August 07, 2024.

Date: July 18, 2024

Ind Bank **Housing Ltd.**

(A Subsidiary of Indian Bank) Registered Office: 3rd Floor, Khivraj Complex 1, No. 480, Anna Salai, Nandanam, Chennai 600 035. CIN No:L65922TN1991PLC020219 Email: indhouse@indbankhousing.com Website: www.indbankhousing.com Ph: 044 2432 9235

Statement of unaudited Financial Results for the Quarter ended 30.06.2024

Year to date Corresponding Three months figures for three months the current ended in the ended SI. Particulars period ended previous year No. 30.06.2024 30.06.2024 30.06.2023 Unaudited Unaudited Unaudited Rs. lakhs Total Income 6.27 6.27 7.66 2. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) (11.92)(11.92)(5.83)3. Net Profit / (Loss) for the period before Tax (11.92)(11.92)(after Exceptional and/or Extraordinary items) (5.83)Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items) (11.92)(11.92)(5.83)Total Comprehensive Income for the period 5 [Comprising Profit/(Loss) for the period (after tax) (11.92)(11.92)(5.83)and Other Comprehensive income (after tax)] Equity Share Capital 1000.00 1000.00 1000.00 Reserves (excluding Revaluation Reserves) 7. as snown in the Audited Balance sneet of previous year (12987.67)Earnings Per Share (of Rs.10/- each) 8. (for continuing and discontinued operations) - 1. Basic

Note: The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange Websites.BSE:www bseindia.com and our company website: www.indbankhousing.com

> V HARIBABU MANAGING DIRECTOR

mahindra Home FINANCE Mahindra Rural Housing Finance Limited

Registered Office: Mahindra Towers, P.K.Kurne Chowk, Worli, Mumbai 400 018.
Telephone No.: 91 22 62929800, Corporate Identity Number: U65922MH2007PLC169791 mercare.mrhfl@mahfin.com, Website : www.mahindrahomefinance.c

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2024

Rs. In Lakhs

SN	Particulars	Quarter ended 30 June 2024	Corresponding Quarter ended 30 June 2023	Previous year ended 31 March 2024
		Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	30,250.42	34,193.75	1,29,443.59
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(7,503.15)	(2,995.38)	484.17
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(7,503.15)	(2,995.38)	484.17
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(5,666.24)	(2,250.77)	360.49
5	Total Comprehensive Income / (Loss) for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5,642.08)	(2,155.28)	375.46
6	Paid up Equity Share Capital	12,235.69	12,214.81	12,233.07
7	Reserves (Including Securities Premium Account)	1,30,986.33	1,33,905.46	1,36,575.89
8	Securities Premium Account	44,098.10	43,691.89	44,045.40
9	Net worth	1,43,222.02	1,46,120.27	1,48,808.96
10	Paid up Debt Capital / Outstanding Debt	5,97,903.89	6,79,056.93	6,34,394.98
11	Outstanding Redeemable Preference Shares	-	-	-
12	Debt Equity Ratio	4.17:1	4.65:1	4.26:1
13	Earnings Per Share (Face value of Rs. 10/- each) - not annualized for interim periods			
	1. Basic: (Rs.)	(4.63)	(1.84)	0.29
	2. Diluted: (Rs.)	(4.63)	(1.84)	0.29

Notes:

: 17 July 2024

- a) The above financial results for the quarter ended 30 June 2024 have been reviewed by the Audit Committee and subsequently approved by e Board of Directors of the Company at its meeting held on 17 July 2024.
- The financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards ('Ind AS') notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and accordingly, these financial results together with the results for the comparative reporting period have been prepared in accordance with the recognition and measurement principles stated therein, prescribed e Companies Act 2013 ('the Act'). Any application guidance / clarifications / directions issued by National Hor (NHB), Reserve Bank of India (RBI) or other regulators are implemented as and when they are issued / applicable
- c) The above is an extract of the detailed format of quarter ended results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 as amended. The full format of the quarter ended financial results are available on www.bseindia.com. www.mahindrahomefinance.com

For and on behalf of the Board of Directors Mahindra Rural Housing Finance Limited CIN: U65922MH2007PLC169791

Shantanu Rege Managing Director & CEO [DIN: 06661312]

In case the Members have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and Instavote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or write an email to rnt.helpdesk@linkintime.co.in or Call us :- Tel: 022 - 49186000 Extn: 2505. The Board of Directors at their meeting held on Thursday, May 23, 2024, recommended a Final Dividend of ₹1.50 (i.e. 30%) per equity

Members are also informed that in terms of provisions of Income Tax Act, 1961, dividend paid and distributed by the Company will be taxable in the hands of the Members and the Company is required to deduct tax at source (TDS) from dividend paid to Members at the

share of face value of ₹5/- each for the Financial Year 2023-24. The Dividend when sanctioned will be payable to those Equity Shareholders, holding shares either in physical form or in dematerialized form on the close of Friday, August 2, 2024 and will be paid on or

the Notice of 6 th AGM.

Register of Members and Share Transfer Books will remain closed from Saturday, August 3, 2024 to Saturday, August 10, 2024 (both days

inclusive) for the purpose of Annual General Meeting and Dividend.

prescribed rates Detailed communication in this regard is provided in the Notice of the AGM.

Sd/ Hemangi Trivedi Company Secretary & **Compliance Officer**

For Cello World Limited

Date: July 18, 2024 Place: Mumbai

ડેન્ટલ અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રથમ રાઉન્ડની ચોર્ડસ ફીલિંગ પ્રક્રિયા શરૂ માંધાનગર: ડેન્ટલ અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રથમ રાઉન્ડની ચોર્ડસ ફીલિંગ પ્રક્રિયા શરૂ

તારીખ 18 જુલાઈથી શરૂ થઈ છે. જે 20 જુલાઈ 2024 સુધી ચાલશે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુસ્નાતક કક્ષાના ડેન્ટલ કોર્સમાં પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ પ્રક્રિયામાં ચોઈસ ફીલિંગ તા. 20 જુલાઈ 2024 સાંજે 4-00 વાગ્યા સુધી કરી શકાશે. જ્યારે 20 જુલાઈ 2024 સાંજે 6-00 વાગ્યા સુધી ઉમેદવાર દ્વારા ભરેલી ચોઇસ જોઈ શકાશે.

ગુજરાત સરકાર સામાજિક વંનીકરણ વિભાગ વલસાડ જાહેર નિવિદા નં. ૦૧ સને ૨૦૨૪-૨૫ (બીજો પ્રયત્ન)

સામાજિક વનીકરણ વિભાગ વલસાડ, હસ્તકની તમામ રેન્જોમાં સને ૨૦૨૪-૨૫ ના વર્ષ દરમ્યાન વિવિદ્ય ઉત્સવની ઉજવણી માટે પુરા પાડવાના માલસામાન માટે રસ ધરાવતા અને ચોગ્યતા ધરાવત ઈજાદારો પાસેથી ટુ બીડ ક્વર પધ્ધતિથી ઓનલાઇન ભાવો મંગાવવામાં આવે છે. ઓનલાઇન ટેન્ડર ફોર્મ ડાઉનલોડ કરવાની તા.૧૯/૦७/૨૦૨૪ તથા ઓનલાઈન ભાવો સબમીટ કરવાની છેલ્લી તા.૦૨/૦૮/૨૦૨૪ સમય ૧૮.૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. ઓનલાઈન ભાવો ભર્ચા બાદ જરૂરી ટેન્ડર ફી, બાનાની રકમ તથા સંવગ્ન દસ્તાવેજો તા.૦૩/૦૮/૨૦૨૪ ૧૬.૦૦ કલાક સુધીમાં સામાજિક વર્નીકરણ વિભાગ વલસાડ,વલસાડની કરોરીમાં રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટ/કુરીયરથી પહોંચાડવાના રહેશે. ઓનલાઇન ભરેલ દેન્ડર સંભવિત તા.03/0૮/૨૦૨૪ ના ૧૬.૩૦ કલાકે ખોલવામાં આવશે. વધુ વિગતો ગુજરાત સરકારની વેબસાઇટ વેબસાઇટ www.statetenders.gujarat.gov.in, www.nprocure.com પરથી મેળવી શકાશે. હવે પછીના બધાજ સુધારા કે સુચનાઓ ઓનલાઇન ૧ અપલોડ કરવામાં આવશે.

નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી. સામાજિક વનીકરણ વિભાગ વલસાડ AXN રિસોર્ટની બાજુમાં, SBI ચણવઇ શાખાની સામે, વલસાડ-૩૯૦૦૪૯ ટેલીફોન નં. ૦૨૬૩૨ ૨૪૩૨૫૮. નં. માહિતી/વલસાડ/૧૧ે૮/૨૦૨૪

સામાજિક વનીકરણ વિભાગ વલસાડ

બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા वाञ्च ६० ६०८ रव्यु

વ્યચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા કચેરીમાં નીચે મુજબની ૧૧ માસ કરાર આધારી કુંગામી જગ્યા ભરવાની હોય નીચે જણાવેલ લાયકાત, વય મર્યાદા તેમજ અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને

તા.૨૯/૦૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે શૈક્ષણિક લાચકાત અને અનુભવના જરૂરી ઓરીજીનલ પ્રમાણપત્રો પ્રાયે બીલીમોરા નગરપાલિકા કચેરી, જલારામ મંદિરની બાજુમાં, સોમનાથ રોડ ખાતે વહીવટીશાખામાં રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા જણાવવામાં આવે છે.									
અ.નં	જગ્યા / હોદ્દો	સંખ્યા	ફિક્સ પગાર રૂા.						
٩	સિટી મેનેજર - SWM (કરાર આધારીત)	q	₹I. 30,000/-						

- (૧)દર્શાવેલ જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારીત ફીક્ષ પગાર થી ભરવાની છે. જે અંગે નક્કી કરેલ કીક્ષ પગાર ઉપરાંત કોઈ પણ પ્રકારના વધારાના ભથ્થા કે કાયમી કર્મચારીને પ્રાપ્ત થતા લાભો મળી શકશે નહીં
- ment/B.E./B.Tech-Civil/M.E./M.Tech-Environment/ M.E./M.Tech-Civ ૪) અનુભવઃ ક્રોગ્રો મેળવ્યા બાદ એક કે તેથી વધુ વર્ષના અનુભવીને ચોગ્ચ પ્રાધાન્થ આપવામાં આવશે
- પ) વચ મર્ચાદા : (અ) ઉમેદવારની વચમર્ચાદા તા. ૧/૦૬/૨૪ ના રોજ ૨૧ વર્ષથી ઓછી નહીં તથા ૩૫ વર્ષથી વધુ નહીં હોર્વ જોઇશે.
- ત્રાગ્યા. (બ) રાજ્ય સરકાર હેઠળ કેટેગરી (SC/ST/OBC/EWS/Women)માં આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારોને વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ૪૫ વર્ષથી વધે નહિ તે મુજબ રહેશે. (ફ)સિટી મેનેજર SWM ની જગ્યા માટે કરાર આધારીત નિમણૂંકના તમામ અધિકાર નગરપાલિકાના અબાધિત ે રહેશે. (७) નિમર્ણુંક પામનાર ઉમેદવારે નગરપાલિકાના ક્વાર્ટરમાં રહેવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનઃ
- વગર મથક છોડી શકાશે નહિ. ડત/- (મિત્તલબેન એમ.ભાલાળા થીફ ઓફિસર બીલીમોરા નગરપાલિક

Wim Plast Ltd.

Regd. ઓફિસઃ સર્વે નંબર 324/4થી 7, ગામ કચીગામ, સ્વામી નારાયણ ગુરૂકુલ રોડ, દમણ - 396210. देखिङ्गोन. नंબर: 022 69970010/ 9377283454; CIN: L25209DD1988PLC001544 ยभิยต: wimplast@celloworld.com; น่ดสเยะ: www.cellowimplast.com

36મી વાર્ષિક સામાન્ય સભા, ઈ-વોટિંગની માહિતી અને બુક ક્લોઝરની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે વિમ પ્લાસ્ટ લિમિટેડ ("કંપની")ના સભ્યોની 36મી વાર્ષિક સામાન્ય સભા ("AGM") શનિવાર, 10 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 11.00 કલાકે (IST) વીડિયો કોન્ફરન્સિંગ ("VC") / અન્ય ઓડિયો વિગ્રયુઅલ માધ્યમો ("OAVM") (ત્યારબાદ "ઇલેક્ટ્રોનિક મોડ" તરીકે ઓળખવામાં આવે છે) દ્વારા વ્યાપારનો વ્યવહાર કરવા માટે યોજાશે. આ મીટિંગ બોલાવતી નોટિસમાં દર્શાવ્યા મુજબ અને તેની જોગવાઈઓનું પાલન કરીને સ્પષ્ટીકરણ નિવેદનમાં નિર્ધારિત છે, કંપની અધિનિયમ, 2013 ("અધિનિયમ") અને તેના હેઠળ બનેલા નિયમો અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015 ("સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સ") ની જોગવાઈઓના પાલનમાં કોર્પોરેટ અફેર્સ મંત્રાલચ ("MCA") સાથે વાંચવામાં આવે છે. 8મી એપ્રિલ 2020નો સામાન્ય પરિપત્ર નં. 14/2020, અને આ સંદર્ભે જારી કરેલા ત્યાર પછીના પરિપત્રો, જેમાં તાજેતરનો એક સામાન્ય પરિપત્ર નં. 09/2023 તારીખ 25મી સપ્ટેમ્બર, 2023 અને સેબીનો પરિપત્ર નં. SEBI/HO/CFD/POD- 2/P/CIR/2023/4 તારીખ 5મી જાન્યુઆરી, 2023 અને સેબી દ્વારા જારી પરિપત્ર નં. SEBI/HO/CFD/CFD-POD- 2/P/ CIR/2023/167 તારીખ 7મી ઓક્ટોબર, 2023ના રોજ આ સંબંધમાં જારી કરાચેલા અન્ય પરિપત્રો સાથે વાંચો. જે સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરી વિના ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા AGM ચોજવાની પરવાનગી આપે છે. સભ્યો ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા આગામી AGMમાં હાજરી આપી શકશે અને ભાગ લઈ શકશે અને પ્રોક્સીની નિમણૂકની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. એક્ટની કલમ 103 હેઠળ કોરમની ગણતરીના હેતુ માટે ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા AGMમાં હાજરી આપનારા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

ઉપરોક્ત પરિપત્રોના પાલનમાં 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ઓડિટેડ નાણાકીય નિવેદન સહિત, નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીના સ્પષ્ટીકરણ નિવેદન અને વાર્ષિક અહેવાલ સાથે AGMની નોટિસની ઇલેક્ટ્રોનિક નકલો એ તમામ સભ્યોને 18 જુલાઈ, 2024ના રોજ મોકલવામાં આવી છે જે સભ્યોના ઇમેઇલ સરનામા કંપની/ડિપોઝિટરી સહભાગીઓ(ઓ) અને/અથવા Link Intime India Pvt. Ltd. સાથે નોંધાયેલ છે.

તે કંપનીની વેબસાઇટ www.cellowimplast.com પર પણ ઉપલબ્ધ છે, BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર, કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ ("RTA")ની વેબસાઇટ https://instavote.linkintime.co.in પર, NSDLની વેબસાઇટ www.evoting.nsdl.com પર અને CDSLની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

AGM દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ માટેની સુચનાઓ

અધિનિયમની ક્લમ 108ની જોગવાઈઓનું પાલન કરીને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, 2014ના નિયમ 20 અને સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સના નિયમન 44 સાથે વાંચો. કંપની તેના સભ્યો (ભૌતિક સ્વરૂપમાં અને ડીમેટ સ્વરૂપમાં શેર ધારણ કરનાર)ને ઇલેક્ટ્રોનિક માધ્યમો (રિમોટ ઇ-વોટિંગ) તેમજ AGMની નોટિસમાં નિર્ધારિત તમામ ઠરાવો પર AGMમાં ઇ-વોટિંગની સુવિધા પ્રદાન કરવામાં પ્રસન્નતા અનુભવે છે. કંપનીએ ઈ-વોટિંગ સુવિદ્યા પૂરી પાડવા માટે LIIPL ની સેવાઓ લીધી છે. મેસર્સ એચએસપીએન એન્ડ એસોસિએટ્સ એલએલપીના નિયુક્ત ભાગીદાર, પ્રેક્ટિસિંગ કંપની સેકેટરીઝ શ્રી હેમંત શેટચેને નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપૂર્ણ ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્કુટિનાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો બુધવાર, 7મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 9.00 વાગ્યે (IST) શરૂ થશે અને શુક્રવાર, 9 ઓગસ્ટ, 2024ના રોજ સાંજે 5.00 વાગ્યે (IST) સમાપ્ત થશે. ત્યાર પછી, LIIPL દ્વારા મતદાન માટે રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલને નિષ્ક્રિય કરવામાં આવશે અને ઉલ્લેખિત તારીખ અને સમય પછી તેને મંજૂરી આપવામાં આવશે નહીં.

સભ્યોના મતદાન એધિકારો 2 ઓગસ્ટ, 2024 ("કટ-ઓફ તારીખ")ના રોજ કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલમાં તેમના દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે. કોઇપણ વ્યક્તિ, જેનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભદાચી માલિકોના રજિસ્ટરમાં ફક્ત કટ-ઓફ તારીખે નોંધાયેલ છે, તે રિમોટ ઈ-વોટિંગ અથવા AGMમાં ઈ-વોટિંગની સુવિધાનો ઉપયોગ કરીને AGMની સુચનામાં નિર્ધારિત તમામ ઠરાવો પર મત આપવા માટે પાત્ર છે..

કોઈપણ વ્યક્તિ, જે નોટિસ મોકલ્યા પછી કંપનીના શેર હસ્તગત કરે છે અને કંપનીના સભ્ય બને છે અને કટ-ઓફ તારીખ એટલે કે 2 ઓગસ્ટ, 2024ના રોજ સુધી શેર ધારણ કરે છે તે AGMની નોટિસમાં ઉલ્લેખિત નિર્દેશોનું પાલન કરીને અથવા enotices@linkintime.co.in પર વિનંતી મોકલીને લોગિન

જે સભ્યો ઈલેક્ટ્રોનિક મોડ હારા AGMમાં હાજર હોય અને જેણે રિમોટ ઈ-વોદિંગ હારા ઠરાવો પર પોતાનો મત ન આપ્યો હોય તેઓ AGM દરમિયાન ઈ-વોટિંગના માધ્યમથી મત આપવાને પાત્ર રહેશે. AGM દરમિયાન ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા અને નિર્દેશ AGMની નોટિસમાં ઉલ્લેખિત છે. જે સભ્યોએ મીટીંગ પહેલા રિમોટ ઈ-વોટીંગ હારા પોતાનો મત આપ્યો છે તેઓ પણ ઈલેક્ટ્રોનિક મોડ હારા મીટીંગમાં હાજરી આપી શકે છે, પરંતુ તેઓ

મીટીંગમાં ફરી પોતાનો મત આપવા માટે હકદાર નથી. જો સભ્યએ કંપની/આરટીએ/ડિપોઝિટરીઝ સાથે તેમનું ઈમેઇલ સરનામું રજિસ્ટર કરાવ્યું ન હોય તો નીચેના નિર્દેશોનું પાલન કરવું જોઈએ:

(i) ફિઝિકલ મોડમાં રાખવામાં આવેલા શેરના કિસ્સામાં:

સભ્ય કૃપા કરીને RTAને rnt.helpdesk@linkintime.co.in પર અથવા કંપનીને investor.grievances@celloworld.com પર ઇમેઇલ કરી શકે છે.

(ii) ડીમેટ મોડમાં રાખવામાં આવેલા શેરના કિસ્સામાં:

સભ્ય કૃપા કરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ("ડીપી")નો સંપર્ક કરી શકે છે અને ડીપી દ્વારા અનુસરવામાં આવેલી પ્રક્રિયા અને સલાહ મુજબ ડીમેટ ખાતામાં ઈમેઇલ એડ્રેસ રજિસ્ટર કરી શકે છે.

જો સભ્યોને ઈ-વોટિંગ અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો તમે મદદ વિભાગ હેઠળ https://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ વારવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને Instavote ઈ-વોટિંગ મેન્ચુઅલ જોઈ શકો છો અથવા enotices@linkintime.co.in પર ઇમેઇલ કરી શકો છો અથવા અમને કોલ કરી શકો છો:- ટેલિફોન: +91-022-4918 6000 Extn: 2505/ 81081 16767.

ડિવિડન્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બુધવાર, 22મી મે, 2024ના રોજ ચોજાચેલી તેમની બેઠકમાં નાણાકીચ વર્ષ 2023-24 માટે રૂા.10/- (માત્ર દસ રૂપિયા) પ્રતિ શેર અંતિમ ડિવિડન્ડ એટલે કે દરેક 10/- પ્રત્યેકના 1,20,03,360 ઇક્વિટી શેર પર 100%ને મંજૂરી અને ભલામણ કરી છે. જો મંજૂર કરવામાં આવે તો ડિવિડન્ડ તે ઇક્વિટી શેરધારકોને ચુકવવાપાત્ર રહેશે, જેઓ ફિઝિકલ સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝડ સ્વરૂપે શેર ધરાવે છે તેમને શુકવાર, ઓગસ્ટ 2, 2024ના અંતે

અને 15 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી ચૂકવવામાં આવશે. સભ્યોને એ પણ જાણ કરવામાં આવે છે કે 1 એપ્રિલ, 2020થી આવકવેરા અધિનિયમ, 1961માં નાણા અધિનિયમ 2020 હેઠળ રજૂ કરવામાં આવેલા સુધારાઓ અનુસાર, કંપની દ્વારા ચકવવામાં આવેલ અને વિતરિત કરાચેલ ડિવિડન્ડ સભ્યોના હાથમાં કરપાત્ર રહેશે અને કંપનીએ નિર્ધારિત દરે સભ્યોને ચુકવવામાં આવેલા ડિવિડન્ડમાંથી રત્રોત પર કર (TDS) કાપવાની જરૂર છે. આ અંગેની વિગતવાર માહિતી AGMની નોટિસમાં આપવામાં આવી છે.

सभ्योनुं रिश्टर अने शेर ट्रान्सइर जुङ शनिवार, 3 ओगस्ट, 2024थी शनिवार, 10 ओगस्ट, 2024 (जंने हिवसो सहित) AGM अने डिविडन्डनी ચુક્વણીના હેતુ માટે બંધ રહેશે.

ફોર વિમ પ્લાસ્ટ લિ. Sd/-દર્શા અડોદ્રા કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર (સભ્ય નંબર: F12831)

તારીખઃ 18 જુલાઈ, 2024 સ્થળઃ મુંબઈ



જાહેરાત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા, જિ.નર્મદા

ગુજરાત સરકાર, આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ધ્વારા રાજપીપલા, જિ.નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૮ થી આર્ટસ, કોમર્સ અને સાયન્સની સ્નાતક કક્ષાની ત્રણ વિદ્યાશાખાઓ શરૂ કરવામાં આવેલ છે. જુદા-જુદા વિષયોમાં કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ, ગુ.રા., ગાંધીનગરની ૧૧ માસ કરાર આધારિત વ્યાખ્યાતા સહાચકની પેટર્ન અનુસાર અત્રેની કચેરી દ્વારા ૧૧ માસ કરાર આધારિત વ્યાખ્યાતા સહાયક मासिङ र्. २५०००/- नां िङ्स वेतनथी सेवा भेजववा के ते विषय निष्यांतोनी ગુણવત્તા ચાદી તૈયાર કરવાની છે, જે તે વિષયમાં વર્કલોડ અને જરૂરિયાત અનુસાર નિમણુંક આપવા અને ભવિષ્યમાં નિયમિત નિમણુંક ન થાય ત્યાં સુધી નિયમાનુસાર સેવા મેળવવા તે માટેની શેક્ષણિક લાચકાત ધરાવતાં ઉમેદવારોએ http://bmtu. ac.in/ વેબસાઇટ પરથી માહિતી અને અરજીપત્ર મેળવી. કુલસચિવશ્રી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા સમક્ષ નિયત નમુનામાં જરૂરી આધાર અને પુરાવાઓ સાથે નીચેના સરનામે લાયકાત અને અન્ય જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો . સાથે તા.૨૫/૦७/૨૦૨૪ નાં રોજ ઉમેદવારે સ્વખર્ચે સવારે ૦૯:૩૦ ક્લાકે ફરજિયાત રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. લાચક અને રસ ધરાવતા ઉમેદવારોને નિમણુક પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી અને નિયત નમુનાનું અરજી ફોર્મ અને તમામ સુચનાઓ http://bmtu.ac.in/ વેબસાઇટ પરથી જોવા વિનંતી.

૧૧ માસ કરાર આંધારિત વ્યાખ્યાતા સહાયકની સેવા મેળવવા અંગેની જાહેરાત

-: सरनामु :-બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (વી.ટી.સી), આર.ટી.ઓ ક્ચેરીની બાજુમાં, વાવડી રોડ, વાવડી-રાજપીપલા, જિ.નર્મદા (કાર્યાલય નંબરઃ ૦૨૬૪૦ - ૨૯૯૬૮૨)

સ્થળ : રાજપીપલા તારીખ :- ૧૮/૦७/૨૦૨૪ માહિતી/નર્મદા/૧૨૯/૨૦૨૪-૨૫

cello

કા.કુલસચિવ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા

पंजाब नैशनल बैंक 🔘 punjab national bank

સર્કલ સસ્ત્ર સેન્ટર : પહેલો માળ, મેઘાણી ટાવર, સ્ટેશન રોડ, સુરત—૩૯૫૦૦૩.

ફોન : ૦૨૬૧-૨૪૫૪૫૪3 email: cs8323@ પરિશિષ્ટ–૪ [જુઓ રૂલ ૮(૧)] કબજા નોટીસ (સ્થાયી મિલકત માટે)

આથી નીચે સહી કરનાર **પંજાબ નેશનલ બેંક** ના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨ (૨૦૦૨ ના ૫૪) કાયનાાન્સયલ અસંદ્રસ અન્ડ અન્કાસંમેન્ટ ઓફ સિકયોરિટી ઈન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨ (૨૦૦૨ ના ૫૪) અને આ ધારા ૧૩(૧૨) સિકયોરિટી ઈન્ટરેસ્ટ (એન્ક્રોસંમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ 3) સાથે વંચાલે લઈ તા.૨૫.૦૪.૨૦૦૪ ના રોજ ડિયાન્ડ નોટીસ બજારી અને ૧૭(૨) તા.૩૦,૦૫.૨૦૪૪ ના રોજ પેપરમાં પ્રસિદ્ધ કરીને દેવાદારો / ગીરવેદાર મેસર્સ શ્રી હરિ કેશન અને શ્રી લશ્મણદાસ ચંદુમલ બ્રહ્માત્રય (ભાગીદાર/જમીનદાર) અને શ્રીમતી પૂજાબેન લશ્મણદાસ બ્રહ્માત્રિય (ભાગીદાર/જમીનદાર) ને નોટીસમાં દર્શાવેલ ૨કમ રૂા.૩૯,૭૨,૫૨૭.૩૭ (અકે રૂા. એગણચાલીસ લાખ બોતેર હજર પાંચસો સત્તાવીસ અને સાડગીસ પૈસા પુરા) તા.૨૫.૦૪.૨૦૨૪ ના રોજના માસિક ગણતરીના આધારે વધારાના વ્યાજ અને અન્ય ચાર્જીસ અને ખર્ચાઓ સાથે આ નોટીસ મળ્યાના 5૦ દિવસની અંદર ૫૨ત ચુકવવા જણાવવામાં આવ્યું હતું.

જણાવવામાં આવ્યું હતું. દેવાદારો આ રકમ ચુકવવામાં અસફળ રહેલ છે. આથી દેવાદાર/જામીનદાર/ગીરવેદાર અને જાહેર જનતાને આ નોટીસથી જણાવવામાં આવે છે કે આ ઘારા ૧૩(૪) ના નિયમ ૮ સાથે વંચાણે લઈ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ હેઠળ નીચે હસ્તાશર કરેલ અધિકારીએ પોતાના અધિકારથી **તા. ૧૬મી જુલાઈ ૨૦૨૪** ના રોજ નીચે દર્શાવેલ વિગતની મિલકતનો કબજો મેળવેલ છે. આથી વિગતમાં દર્શાવેલ દેવાદારો/ગીરવેદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે મિલકતો માટે કોઈ પણ વ્યવહાર કરવો નહિં અને જો કોઈપણ વ્યવહાર કરવો હોય તો **પંજાબ નેશનલ**

બેંકની બાકી રકમ રૂા.૩૯,૭૨,૫૨૭.૩૭(અંકે રૂા. ઓગક્ષચાલીસ લાખ બોતેર હજાર પાંચસો સત્તાવીસ અને સાડગ્રીસ પૈસા પુરા) તા.૨૫.૦૪.૨૦૨૪ ના રોજના અને તેના ઉપરના વધારાના વ્યાજ ને આધિન દેવાદારોનું ધ્યાન દોરવાનું કે તમને નિયમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈ મુજબ સુરક્ષીત મિલકતો છોડાવવા માટે પુરતો સમય આપેલ છે.

સ્થાચી મિલકતનું વર્ણન

ામામ્ હક્ક, હિત અને સંબંધ ધરાવતી સ્થાયી મિલકત 'વેસ્ટર્ન સીટી નામની બિલ્ડીંગ નં. ઈ ના સાતમા માળનો ફ્લેટ નં.૭૦૧ જેનું સુપર બિલ્ટ અપ માપ આશરે ૧૧૮૦.૦૦ ચો.ફ્ટ યાને ૧૦૯.૬૬ ચો.મી. અને માળના રહેટ 1.301 જનુ સુપર ાખેટ અપ માપ આશર ૧૧૮૦.00 વાંકુટ વાન ૧૦૯.5> વા.મા. અન બિલ્ટ અપ એરવા માપ આશરે ૯૦૦.૨૪ ચાંકુટ યાને ૮૪.૨૨ ચાં.મી. જેની આશરે ૩૧.૭૮ ચાં.મી જમીનના પ્રમાણસર વણાવહૈયાયેલ હિસ્સા સહિત રેવન્યુ સર્વ નં.૨૧૯/૧ પૈકી, બ્લોક નં.૨૭૦/૧ અને ૨૭૦/૨, ટી.પી.સ્ક્રીમ નં.૧૦ (પાલ), ફાઈનલ પ્લોટ નં.૯૨, ૧૩૫, ૧૪૫ એલ.પી.સવાણી સ્કૂલ પાછળ, પાલ રોડ, ગામ પાલ, તાલુકા : અડાજણ (સુરત સીટી) જી. : સુરત ખાતે શ્રી લક્ષ્મણદાસ ચંદુમલ બ્રહ્મસિય અને શ્રીમતી પૂજાબેન લક્ષ્મણદાસ બ્રહ્મસિય ની માલિકીનો આવેલ છે. જેની ચતૃદિશા : પૂર્વ તરફ : બિલ્ડીંગ નં.સી, પશ્ચિમ તરફ : ફલેટ નં.૭૦૨, ઉત્તર તરફ : પ્રવેશ પેસેજ અને ફ્લેટ નં.૭૦૪, દક્ષિણ તરફ : ખુલ્લી ૪ગ્યા અને ગાર્ડન આવેલ છે.

તારીખ : ૧૬.૦૭.૨૦૨૪ | સ્થળ : સુરત

અધિકૃત અધિકારી, પંજાબ નેશનલ બેંક

સેલો વર્લ્ડ લિમિટેડ

Regd. ઓફિસ: 597/2A, સોમનાથ રોડ, દાભેલ, નાની દમણ, દમણ અને દીવ - 396 210. (ભારત) કોર્પોરેટ ઓફિસ: સેલો હાઉસ, કોર્પોરેટ એવન્થુ, 'બી' વિંગ, 8મો માળ, સોનાવાલા રોડ, ગોરેગાંવ (પૂર્વ), મુંબઈ - 400 063, (ભારત), टेલिङोन. नंभर: 022- 69970000; CIN: U25209DD2018PLC009865

ਈਏਰ: grievance@celloworld.com; ਹੇਯੁਣਗਿਤ: www.corporate.celloworld.com

6ફ્રી વાર્ષિક સામાન્ય સભાની નાટિસ અને રિમોટ ઈ-વોટિંગ માહિતી અને બુક ક્લોઝર

આથી સૂચિત કરવામાં આવે છે કે સેલો વર્લ્ડ લિમિટેડ ("કંપની")ના સભ્યોની 6ફ્રી વાર્ષિક સામાન્ય સભા (AGM) શનિવાર, 10 ઓગસ્ટ, 2024ના રોજ ઝપોરે 03.30 (IST) વાગ્યે યોજાશે. વિડીયો કોન્ફરન્સિંગ ("VC") / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો ("OAVM") (ત્યાર બાદ "ઇલેક્ટ્રોનિક મોડ" તરીકે ઓળખવામાં આવે છે) દ્વારા વ્યવસાયનો વ્યવહાર કરવા માટે આ મીટિગ બોલાવતી નોટિસમાં દર્શાવ્યા મુજબ અને તેના નિવેદનાત્મક સ્પષ્ટીકરણમાં નિર્ધારિત છે, કંપની અધિનિયમ, 2013 અને તેના હેઠળ બનાવેલા નિયમોની જોગવાઈઓ અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્લાચરમેન્ટ્સ) રેગ્ચુલેશન્સ, 2015ના અનુપાલનમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલચ ("MCA")ના પરિપત્રો 8 એપ્રિલ, 2020, 13 એપ્રિલ, 2020, 5 મે, 2020, 13 જાન્યુઆરી, 2021, 8 ડિસેમ્બર, 2021, 5 મે, 2022, અને

28 ડિસેમ્બર, 2022 અને પરિપત્રો તારીખ 12 મે, 2020, 15 જાન્યુઆરી, 2021, 13 મે, 2022 અને 5 જાન્યુઆરી, 2023ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સરોન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ, સામાન્ય સ્થળે સભ્યોની હાજરી વિના વાંચવામાં આવ્યા છે.

સભ્યો ઓડિયો-વિઝયુઅલ માધ્યમ દ્વારા આગામી એજીએમમાં હાજરી આપી શકશે અને ભાગ લઈ શકશે અને પ્રોક્સીની નિમણૂકની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ઓડિયો વિઝયુઅલ માધ્યમથી એજીએમમાં હાજરી આપનારા સભ્યોને કંપની એક્ટ, 2013ની કલમ 103 હેઠળ કોરમની ગણતરી કરવાના કેતુથી ગણતરી કરવામાં આવશે.

એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ માટેની સૂચનાઓ:

સંબંધિત પરિપત્રોના પાલનમાં એજીએમની સૂચના, સ્પષ્ટ નિવેદન અને નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીનો વાર્ષિક અહેવાલ, જેમાં 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા વર્ષ માટેના નાણાકીય વિવરણ સામેલ છે, એ તમામ સભ્યોને 18 જુલાઈ, 2024ના રોજ મોક્લવામાં આવી છે, જેમના ઇમેઇલ સરનામાં કંપની/ ડિપોઝિટરી સહભાગીઓ(ઓ) અને/અથવા Link Intime India Pvt. Ltd. (RTA)સાથે નોંધાચેલ છે. તે કંપનીની વેબસાઇટ www.corporate.celloworld. com પર પણ ઉપલબ્ધ છે અને BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ www.nseindia.com પર અનુક્રમે અને કંપનીની RTA Link Intime India Pvt.Ltdની વેબસાઇટ https://instavote.linkintime.co.in પર પણ ઉપલબ્ધ છે.

કંપની અદ્યિનિચમ, 2013ની કલમ 108ની જોગવાઈઓના પાલનમાં કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિચમો, 2014માં સુધારેલ અને SEBI િલસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015ના રેગ્યુલેશન 44 મુજબ, કંપની તેના સભ્યોને (ભૌતિક અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શેર હોલ્ડિંગ)ને ઇલેક્ટ્રોનિક માધ્યમો (રિમોટ ઇ-વોટિંગ) દ્વારા તેમના મતનો ઉપયોગ કરવાની સુવિધા પ્રદાન કરવા માટે ખુશ છે. તેમ જ 6ફ્રી એજીએમની સૂચનામાં દર્શાવેલ તમામ ઠરાવો પર એજીએમમાં ઇ-વોટિંગ પર કરી શકે છે. કંપનીએ ઇ-વોટિંગ સુવિધા પૂરી પાડવા માટે Link Intime India Pvt. Ltd. ("LIIPL")ની સેવાઓ લીઘી છે. M/s સરવૈચા એન્ડ કં.ના માલિક શ્રી ધર્મેશ સરવૈચા, કંપની સચિવને નિષ્પક્ષ અને પારદર્શક રીતે રિમોટ ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે તપાસકર્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રિમોટ ઈ-વોટિંગ સમચગાળો બુધવા૨, 07 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 9.00 વાગ્ચે (IST) શરૂ થશે અને શુક્રવા૨, 09 ઓગસ્ટ, 2024ના રોજ સાંજે 5.00 વાગ્ચે (IST) સમાપ્ત થશે. ત્થાર બાદ LIIPL દ્વારા મતદાન માટે રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલને નિષ્ક્રિય કરવામાં આવશે.

સભ્યોના મતદાન અધિકારો 02 ઓગસ્ટ , 2024 ("કટ-ઓફ તારીખ") સુધી કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલમાં તેમના દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે. કોઈપણ વ્યક્તિ, જે કટ-ઓફ તારીખ સુધી કંપનીના સભ્ય છે તે રિમોટ ઈ-વોટિંગ અથવા એજીએમમાં વોટિંગનો ઉપયોગ કરીને એજીએમની સૂચનામાં નિર્દારિત તમામ ઠરાવ પર મત આપવા માટે પાત્ર છે.

કોઈપણ વ્યક્તિ, જે નોટિસ મોકલ્યા પછી કંપનીના શેર મેળવે છે અને કંપનીના સભ્ય બની જાય છે અને કટ-ઓફ તારીખ એટલે કે 02 ઓગસ્ટ, 2024ના રોજ શેર ધરાવે છે, તે એજીએમની સૂચનામાં ઉલ્લેખિત નિર્દેશોને અનુસરીને અથવા rnt.helpdesk@linkintime.co.in પર વિનંતી મોક્લીને લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે.

જે સભ્યો એજીએમમાં VC/OAVM દ્વારા હાજર હોય અને તેઓએ રિમોટ ઈ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો મત ન આપ્યો હોય તેઓ એજીએમ દરમિયાન ઈ-વોટિંગ દ્વારા મત આપવા માટે પાત્ર હશે. એજીએમ દરમિયાન ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા અને સુચનાઓનો ઉલ્લેખ 6ફી એજીએમની નોટિસમાં

જો સભ્યએ કંપની/આરટીએ/ડિપોઝિટરીઝ સાથે તેમનું ઈમેલ સરનામું રજીસ્ટર કરાવ્યું ન હોય તો તેમણે નીચેની સુચનાઓનું પાલન કરવું જોઈએ:

(i) ફિઝિકલ મોડમાં રાખવામાં આવેલા શેરના કિસ્સામાં:

સભ્ય ફ્યા કરીને RTAને rnt.helpdesk@linkintime .ci. o.in પર અથવા કંપનીને grievance@celloworld.com પર ઇમેઇલ કરી શકે છે.

(ii) ડીમેટ મોડમાં રાખવામાં આવેલા શેરના કિસ્સામાં

સભ્ય કૃપા કરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ("ડીપી")નો સંપર્ક કરી શકે છે અને ડીપી દ્વારા અનુસરવામાં આવેલી અને સલાહ મુજબ ડીમેટ ખાતામાં ઈમેલ ખેડ્રેસ રજસ્ટર કરી શકે છે. જો સભ્યો પાસે ઈ-વોટિંગ અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો તમે મદદ વિભાગ હેઠળ https://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ વારંવાર

પૂછાતા પ્રશ્નો ("FAQs") અને Instavote ઈ-વોટિંગ મેન્થુઅલનો સંદર્ભ લઈ શકો છો. અથવા rnt.helpdesk@linkintime.co.in પર ઇમેઇલ કરી શકે છે અથવા અમને કોલ કરી શકો છો:- ટેલિફોન: 022- 49186000 Extn: 2505.

કિ**વિક**ન્ડ

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 23 મે, 2024 ને ગુરુવારે યોજાયેલી તેમની બેઠકમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ₹5/- પ્રત્યેકની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરદીઠ ₹1.50 એટલે કે 30%)ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી. જ્યારે મંજૂર કરવામાં આવે ત્યારે ડિવિડન્ડ તે ઇક્વિટી શેરધારકોને ચૂકવવાપાત્ર રહેશે, જેઓ શુક્રવા૨, 2 ઓગસ્ટ, 2024ના ફિઝિક્લ સ્વરૂપે અથવા ડીમટીરિચલાઈઝડ સ્વરૂપે રાખે છે અને તેની ચુક્વણી 15 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી કરવામાં આવશે.

સભ્યોને એ પણ જાણ કરવામાં આવે છે કે, આવકવેરા અધિનિયમ, 1961ની જોગવાઈઓ અનુસાર, કંપની દ્વારા ચૂકવવામાં આવેલ અને વિતરિત કરવામાં આવેલ ડિવિડન્ડ સભ્યોના હાથમાં કરપાત્ર રહેશે અને કંપનીએ નિર્ધારિત દરો પર સભ્યોને ચૂકવવામાં આવેલા ડિવિડન્ડમાંથી સ્ત્રોત પર કર (TDS) કાપવાની જરૂર છે. આ અંગેની વિગતવાર માહિતી એજાએમની નોટિસમાં આપવામાં આવી છે.

વાર્ષિક સામાન્ય સભા અને ડિવિડન્ડના હેતુ માટે શનિવાર, 3 ઓગસ્ટ, 2024થી શનિવાર, 10 ઓગસ્ટ, 2024 સુધી (બંને દિવસો સહિત) સભ્યોનું રિજસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ બંધ રહેશે.

શો-રૂમ લાચક

મકાન ભાડે આપવાનું છે

થાર રસ્તા પર કોર્નરની મોકાની જગ્ય

्रेरेडन्ड इलोर ४५०० इंट 🖊 क्वेंबा

પાવર, જનરેટર, ફાયર સેફ્ટી અને લિફ્ટ સાથે ફુલ ફર્નિચરવાળી ઓફિસ

. કેડ્રેસઃ તિરૂપતિ ઈન્ટરનેશનલ, ચોસઠ, જોગણી માતાજી મંદિર પારે

ीहरा पोवीस स्टेशननी सामे, **ઉधना-मह**गहत्वा रोऽ, सु

Call- 98251 13613

સાંઈયાત્રા સ્લીપર

90000

ગ્રાઉન્ડ ફ્લોર (૦૦૦ ફૂટ)

इस्ट इंलोर ४५०० ईंट

તારીખ: 18 જુલાઈ, 2024 સ્થળઃ મુંબઈ

ફોર સેલો વર્લ્ડ લિમિટેડ Sd/- હેમાંગી ત્રિવેદી કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર

૩૧-૦૫-૨૦૨૨ થી લાગ્ શાબ્દ દીઠ ₹ 🗲 માં ઓછા ૧૨ શબ્દો જાહેરખબર આપવા માટે મળો : ગુજરાતમિત્ર ભવળ, સોળી ફળીયા, સુરત. ફોળ : ૨૫૯૯૯૧ ફેક્સ : ૨૫૯૯૯૦

ह्याञ्चा осм ३ પેન્ટપીસ

વ્યવસાયીક

1199/-ફ્રેશ માત્ર તાકામાંથી 1.20 ફૂટ, આલીશાન, ભવાનીવડ, હરિપુરા. સુરત. (669) PRESIDENT PEST CONTROL 35 વર્ષથી ચાલતું એવોર્ડથી લાયસન્સ

9825819250 કબૂતર, મચ્છર જાળી ઘરબેઠા ફિટિંગ, રોયલ નેટ સ્પાઈક. 9737166947, 8758533196

સન્માનિત

CM PEST CONTROL

લાઈફ ટાઈમ ખાત્રીપૂર્વક ટ્રીટમેન્ટ. ઉધઈની 9377672958/937472601

ઘરબેઠા વજન વધારો ઘટાડો મહિને 2 થી 5 કિલો. 8980949264

ઘરબેઠા તાતકાલિક LED રીપેરીંગ ઈલે કટ્રોનિકસ મોબાઈલ, રીમોટ, વિનોદ રેડિયો, લાલદરવાજા.

9328436184

Income Tax,

તેમજ GST, ફાઇલિંગ માટે સંપર્ક કરો. ચંદ્રેશભાઇ પટેલ, ઓવન, અડાજશ 9427284183 કેરહોમ. 7859985601 नंदनी गृहम

(640)

(644)

યોગ ધ્યાન હેતું સંપર્ક કરે 9426140829, 9429576633,

ઘરબેઠા TV,LCD, રીપેરીંગ દરેક LED વિસ્તારમાં, દામીની ઈલેક્ટ્રોનીકસ, અડાજણ

9429573366

9898302700 પતરાના શેડ

અને લિફટ બનાવવા માટે. 9979989971

લાઈફ હિંચકાના

કડાં, અમેરીકન ટેક્નોલોજીથી તોડફોડ કર્યા વગર ગેરેન્ટેડ ફિટીંગઃ 8460222292 8460222282 (595) (703)

ઘરબેઠા રીપેરીંગ

વોશીંગ મશીન, માઇક્રોવેવ ફ્રિઝ. બાલાજી 9825859049, (704)

ઘરબેઠા LED,

PLAZMA રીપેરીંગ. સાંઈકૃપા ΤV ઈલેક્ટ્રોનિક્સ. અડાજણ. 9313600618 (706)



ફાર્મ હાઉસ

તથા ડોમ ફેબ્રીકેશન કામ માટે બેસ્ટ 25 ગુંઠા કેરીની વાડી વેચવાની છે, ધમડાછા ગણદેવી પાસે, જિલ્લો નવસારી. 9426510000 (550)

બંગલા વેચવાના

પારલેપોઈન્ટ ઘોડદોડ વેસુ પીપલોદ ન્યુ સીટીલાઈટ દલાલ માફ્ર. 9909775590 (700)

પાલમાં દુકાન વેચાણ કરારથી આપવાની છે.

460 सुपर બિલ્ટઅપ એરિયા ગ્રાઉન્ડ ફ્લોર એરસ ફૂટ પર નિસલ સર્કલ પાસે વેચાણથી આપવાની છે 9712979399

બંગલો વેચવાનો છે. વાર અઠવા આર્દશ સોસાયટી Mo:

(701)

પાર્લેપોઈન્ટ પંચવટી સોસાયટીમાં કોર્નરનું ગ્રાઉન્ડ+૨ મકાન વેચવાનું છે. 9376925382 (702)

9377304090



ઓફિસનાં કામ

છોકરીઓ જોઈએ માટે છે. કડોદરા. 9033523121

उप०० रहे. डूट ોર્પોરેટ ઓફીસ ભાડે

IT. CA, સોફ્ટવેર, ક્સ્ટમરકેર ઓફીસોને લાયક કુલ ફર્નીચર સાથે, રીસેપ્શન, કીચન, રેસ્ટરૂમ સ્ટાફ ઓફીસો અને બોશ ઓફીસો એડ્રેસ: ૪૦૧, સિલ્વર સ્ટોન આર્કેડ, કંથેરીય માન મંદિર, ડી માર્ટ પાસે, વેડરોડ, સુરત Call- 98251 13613



नर्भद्य डिनारे

કાલસર્પ પિત્રુદોષ નિવારણ અમાવસે, જન્મ પત્રિકા માર્ગદર્શન તુલસી શક્તિવિર મહારાજ હનુમાન મંદિર, સીટીલાઇટ રોડ, સુરત. 9825294833

ત્યવસાયોક याथा-प्रवास्य राष्ट्रा

स्वप्न ट्रावेर्स्स, રેલ્વે 2+2 દ્વારા દીપકભાઈ

સંચાલીક બોડીવાલા શ્રાવણ માસમાં શ્રીશૈલમ સાથે હૈદરાબાદ, તિરૂપતિ, રામેશ્વરમ, કન્યાકુમારી તા. 8/8, દિ- 10-11, ચારધામ, કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી. ગંગોત્રી, તા. 18/8, 5/9, 17/9 અને 3/10/2024, & 14-15 સંપુર્શ સગવડતા સહિત મળો- યોગી કોમ્પલેક્ષ ન્યુ રાંદેર રોડ , સુરત 9825144143,

9898700934,

9712882315

બુકીંગ ચાલુ છે (678)

દિવાળી

દર રવિવારે

નોંધ-

સાપુતારા. જન્માષ્ટમી સ્પેશિયલ. જેસલમેર, સમડેઝર્ટ, રણુજા, જોધપુર, માઉન્ટઆબુ, 4 દિવસ, 24/08. અયોધ્યા, કાશી, અલ્હાબાદ, ઉજ્જેન, ઓમકારેશ્વર, 8 દિવસ, 09/08. ઉજ્જૈન, ઓમકારેશ્વર, 2 દિવસ, 17/08. સ્લીપર પ્રવાસોનું સીટિંગ બસ ભાડે મળશે. 9824123641 (705)

કેરલા, કન્યાકુમારી, રામેશ્વર, મદુરાઇ 30

કાશ્મીર, ઓગસ્ટ. વૈષ્શોદેવી, અમૃતસર, 18 સપ્ટેમ્બર. નીલકંઠ ટ્રાવેલ્સ, જૂના જાણીતા રાજુ મોદી. 9374512979 (દિવાળી બુકિંગ શરૂ) (699) તુલા રાશિ ફ્રી સલાહ

ખાત્રીપૂર્વક કામ, 151% ટ્ટેલા પ્રેમ, લગ્ન, સગાઈ,

સંબંધ, જોડવા માટે, કુંડળી કામ ધંધા વેપાર, ઘર કંકાસ નિવારણ 9892390875 (શિવધારા ઉપાસક) ઘર બેઠા ૮યુકડી જાહેરાત આપવા

જે. આર. ટુર્સ ઉપડશે 14 સપટેમ્બર,

આદિકૈલાસ, ઓમ પર્વત લીપુલેખથી તિબેટ કૈલાસ દર્શન, નીમકરોલી, દિન-10 4 નવેમ્બર, સ્પે- કેરાલા **દિન-11.** ડિસેમ્બર-16 જગનાથપુરી,કોલકતા,

ગંગાસાગાર ગયા, બૈજનાથ, વારાશસી, અલ્હાબાદ ત્રિવેશી સ્નાન, અયોધ્યા, લખનૌ નૈમીષારણ. દિ-15 9825534460 (618)

માટે સંપર્ક કરો M. 9879663828



અગત્યની સુચના : ટચુકડી જાહેરખબરમાં પ્રસિધ્ધ થયેલી માહિતી અંગે વાચકે પુરતી ચકાસણી કરી લેવા વિનંતી. જાહેર ખબરની વિગતોની સત્યતા અંગેની અખબારની જવાબદારી રહેશે નહીં.